

# **Ambalal Sarabhai Enterprises Limited**

Registered Office : Shantisadan, Mirzapur Road, Ahmedabad-380001. Telephone : +9179-25507671 / 25507073, Fax : +9179-25507483, E-mail : ase@sarabhai.co.in

Ref. No. :

Date :

Date: 25.05.2024

То

# The General Manager,

Department of Corporate Services, Bombay Stock Exchange Limited, Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai- 400001. Scrip Code: 500009

# Subject: Newspaper advertisement- Disclosure under Regulation 30 and Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations")

Dear Sir,

Pursuant to Regulation 30 and Regulation 47 of SEBI Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we hereby enclose copies of newspaper clippings of the publication of the extract of the Audited Financial Results (Standalone and Consolidated) for the Quarter and year ended on March 31, 2024 published in Business Standard (English) & Jai Hind (Gujarati) - Ahmedabad on May 25, 2024.

You are requested to take the same on your record.

Thanking you,

For Ambalal Sarabhai Enterprises Limited

Ms. Disha M. Punjani Company Secretary & Compliance Officer A55612

# Johnson Controls-Hitachi Air Conditioning India Limited

Regd. Office: 9th Floor, Abhijeet, Mithakhali Six Roads, Ahmedabad: 380 006 Chix: L29300GJ1984PLC007470 Tel: + 917926402024, E-mail: hitachi@jci-hitachi.com, Website: www.jci-hitachi.in EXTRCT OF STANDALONE FINANCIAL RESULTS FOR THE GUARTER AND YEAR ENDED 31/03/2024

Sr.	Particulars	Quarter	ended	Year e	nded
No.		31-03-2024	31-03-2023	31-03-2024	31-03-2023
		(Unaudited)	(Unaudited)	(Audited)	(Audited)
1	Total income from operations	771.8	5,476.2	19,187.0	23,844.4
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/ or	668.3	45.6	(721.6)	(896.3
	Extraordinary Items)				
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/ or	650.6	21.6	(990.0)	(1,051.9
	Extraordinary Items)				
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/ or	162.5	32.2	(232.9)	(230.5
	Extraordinary Items)				
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss)	47.8	(4.3)	(762.0)	807.0
	for the period (after tax) and Other Comprehensive Income (after tax)]				
6	Equity Share Capital (Face value Rs.10 per share)	271.9	271.9	271.9	271.9
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Audited			5,557.8	6,319.8
	Balance Sheet of previous year)				
8	Basic and Diluted Earnings Per Share (before and after extra ordinary	18.0	(0.4)	(27.8)	(30.2
	items) (of Rs. 10 each) (Not annualised) (Rs.)				

N o t e s 1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchanges (www.bseindia.com, www.nseindia.com) and the company's website(www.ic)-hitach.ini). 2. The above financial results are prepared in compliance with Indian Accounting Standard ("Ind AS") as notified under section 133 of the Companies Act, 2013 ("the Act") [Companies (Indian Accounting Standards) Rules, 2015], as amended.

Place: Mumbai Date: 23rd May, 2024 e: Mumba For and on behalf of the Board of Director

Sanjay	Sudhaka

Managing Director

METROGLOBAL LIMITED Regd. Office: 506-509, Shilp, Opp. Girish Cold Drinks, C.G. Road, Navrangpura, Ahmedabad - 380009 Email : cs@metroglobal.in, Website : www.metrogloballimited.com, CIN: L210106J1992PLC143784 双 METROGLOBAL IT OF FINANCIAL RESULTS FOR THE QUARTER AND FINANCIAL YEAR ENDED MARCH 31, 2024

Sr.				STANDALON					CONSOLIDATED				
	Particulars	L	Quarter Ende	bt	Year	Ended	<u> </u>	Quarter Ende	ed	Year Ended			
No.	Faluculars				31.03.2024		31.03.2024						
		Audited	Unaudited	Audited	Audited	Audited	Audited	Unaudited	Audited	Audited	Audited		
	Total Income	6,583.90	7,118.51	8,023.67	24,592.43	24,772.26	6,593.36	7,120.50	8,023.78	24,604.51	24,772.9		
	Net Profit / (Loss) for the period	1 '	'	'	1 1	1 1	d I	1 1	'	1			
	(before Tax, Exceptional and/or Extraordinary items)	1.036.94	521.97	911.93	2.090.04	2,428.10	1.059.68	519.74	911.29	2.130.09	2.433.8		
	Net Profit / (Loss) for the period	1,030.54	021.01	911.55	2,050.04	2,420.10	1,005.00	010.14	911.25	2,130.05	2,455.0		
	before tax (after Exceptional and/or	1 '	1 '	'	1 1	1 1	d I	1 1	'	1			
	Extraordinary items)	1,036.94	521.97	911.93	2,090.04	2,428.10	1,059.68	519.74	911.29	2,130.09	2,433.8		
	Net Profit / (Loss) for the period	1 '	1 '	'	1 1	1 1	d I	1 1	'	1			
	after tax (after Exceptional and/or			1	1	1			740.00	1 000 10			
	Extraordinary items) Total Comprehensive income for the	792.86	403.38	719.49	1,588.64	1,907.49	815.38	401.04	718.80	1,628.49	1,913.1		
	period	727.71	1.248.73	(931.09)	3.650.98	476.02	761.73	1.253.74	(852.77)	3.730.48	560.6		
	Equity share capital (Face Value of	1	1,2,2,1,1,1	(00	1 0,000	1	10	1,202	(002)	0,10			
	Rs 10/- each )	1,233.44	1,233.44	1,233.44	1,233.44	1,233.44	1,233.44	1,233.44	1,233.44	1,233.44	1,233.4		
	Reserve and Surplus (excluding		-!		35,726.55	32,383.93	d - I	1 - 1	- 1	35,801.37	32,387.6		
	Revaluation Reserve) Earnings Per Share (EPS) (of Rs.	'	1 '	'	1 1		( I	1 1	1	1	1		
	Earnings Per Share (EPS) (of Rs. 10 Each) (Not annualized for	1 '	1 1	'	1 1		d P	1 1		1			
	Quarters) (Including Other	1 '	'	'	1 1	1 1	d I	1 1	'	1			
	Comprehensive Income)	1 '	'	'	1 1	1 1	d I	1 1	'	1			
- 1	a) Basic	5.90	10.12	(7.55)	29.60	3.86	6.18	10.16	(6.91)		4.5		
	b) Diluted	5.90	10.12	(7.55)	29.60	3.86	6.18	10.16	(6.91)	30.24	4.5		

These transcail results have been prepared in accordance with applicable indian Accounting Standards ("Ind As") notified under the Companies (India Standards) Ruka; 2015 as anneted, as specified in section 130 of the Companies AL 2013. The Board of Directors have recommended a divident of Rs. 21-@20% per Equity share of face value of Rs. 101- each, subject to approval from the share ensuina AGM.

 A Previous period figures have been regrouped/rearranged whenever necessary for comparison purposes
 The Financial Results are available on the BSE Limited website <u>www.bseindia.com</u> & on the company's For and on behalf of Board of D

Date: May 24, 202 Place: Ahmedoke

Date : 24.05.2024 Place : Vadodara

(Gautam M. Jain) nan & Managing Dire naging Directo

#### Ambalal Sarabhai Enterprises Limited® ase CIN: L52100GJ1978PLC003159

Regd. Office: Shanti Sadan, Mirzapur Road, Ahmedabad - 380001

Phone : 079-25507671, 25507073 | Website: www.ase.life | E-mail: ase@sarabhai.co.in

	RACT OF AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS						
			() Quarter ended	₹ in Lakhs,			
Sr.	Particulars			1	Year ended		
No.	, and and	31.03.2024 Audited	31.12.2023 Unaudited	31.03.2023 Audited	31.03.2024 Audited	31.03.2023 Audited	
1	Total Income from Operations	5913.49	4447.35	4880.01	18394.52	18277.28	
	(Including Other Income)	5913.49	4447.35	4880.01	18394.52	18277.28	
2	Net Profit / (Loss) for the period (before tax and exceptional items)	829.10	203.44	715.08	665.10	1517.21	
3	Net Profit / (Loss) for the period before tax and after exceptional items	829.10	203.44	715.08	665.10	1517.21	
4	Net Profit / (Loss) for the period after tax and exceptional items	901.83	133.28	571.16	568.07	1144.79	
5	Total Comprehensive Income for the period {Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)}	922.12	108.81	538.94	632.65	1071.21	
6	Paid-up Equity Share Capital (Face Value ₹ 10/- Per Share)	7663.33	7663.33	7663.33	7663.33	7663.33	
7	Other Equity as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	6049.95	5428.98	
8	Earnings Per Share (of ₹10/- each) Basic and Diluted Earning Per Share (Not Annualized) (in ₹)	1.18	0.18	0.76	0.74	1.49	
Not 1. K	es : ey numbers of Standalone Results are as under:					(₹ in Lakhs)	
			Quarter ended		Year		
	Particulars		31.12.2023				
Tet	d la sur faces (a surtis es (includio e Other la sure)	Audited	Unaudited	Audited	Audited	Audited	
	al Income from Operations (including Other Income) Profit / (Loss) before tax	440.54 266.18	165.24 (38.46)			1424.07 433.67	
	Profit / (Loss) after tax	469.72	(65.09)	122.92		433.67	
3.	The above is an extract of the detailed format of the Financial R Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obliga the Standalore and Consolidated Financial Results are availab Company's Website (www.ase.iife). The above financial results have been reviewed by the Audit Con Saord of Directors at their meeting held on 24th May, 2024.	tions & Disclo: le on the webs nmittee at their	sure Requirem ite of the Stock r meeting held	nents) Regulat k Exchange (w on 24th May,	ions, 2015. Th ww.bseindia.c 2024 and app	ne full format com) and the roved by the	
4.	These results have been prepared in accordance with the Compa under Section 133 of the Companies Act 2013 and other recognic The figures for the previous periods have been regrouped wherev	zed accounting	practices and	policies to the	extent applic	able.	

An immovable property of borrower (mortgage comprising of land & buildings and erections thereon (both present and future) situated at all that bipece and pareel (brow) Sevasi Biotex 233,244 old Survey No. 307,305 The no. 2(SEVASI) old FP no. 109,110 AF [at C, 1020 5th Floor Avadh Heights Sevals Vadodara Reg. Dist Vadodara. Built Ja paree 80,25 arth: Undivided Common Plot & Land Area 24,35 Sqmtr. Bounded: East Lagu Common

Passage Dadar & open to Sky, West: Lagu Open to Sky, North: Lagu Open to Sky, South: Lagu Flat No. C /501.	L	a
Date: 25.05.2024 Authorised Officer Place : Vadodara State Bank of India		A S

Description of Equitable Mortgage of Immovable property

trice. crower having failed to repay the amount, notice is hereby given to ver, legal heirs (known - unknown), legal representatives (known - unknow thor and the public in general that the undersigned has taken Symbo Ssion of the property described herein below in exercise of powers confer under Section 13(4) of the said [Act] read with Rule 8 of the said rules on 1 model and the result of the said [Act] read with Rule 8 of the said rules on 1

STATE BANK OF INDIA

he undersigned being the Authorized C uth under the Securitization and Recons

Retail Assets Central Processing Centre, 2nd Floor SWC Hub, SBI RACPC South, Vasna Bhayli Road,

ficer of S

**O** SBI

L.	PEGASUS ASSETS RECONSTRUCTION PRIVATE LIMITED								
ľ	Se l	55-56,5th Floor Free Press House Nariman Point,							
I	PEGASUS	Mumbai -400021 Tel: -022-61884700 I: sys@pegasus-arc.com URL: www.pegasus-arc.com							
h		OTICE FOR SALE BY E-AUCTION							
	Sale of Immovable Propert	ies under the Securitization and Reconstruction of Financial							
	Assets and Enforcement of Security Interest Act, 2002 read with Rule 8 and 9 of the Security Interest (Enforcement) Rules, 2002								
h	Notice is hereby given to the p	ublic in general and in particular to the below mentioned Borrower(s)							
	and Co-Borrower(s) that the	below described secured assets being immovable properties							
		cured Creditor, Pegasus Assets Reconstruction Private Limited are of Pegasus Group Thirty Nine Trust 2 (Pegasus), having been							
		w mentioned Borrower along with underlying securities interest by							
		nent Agreement dated 30/09/2021 under the provisions of the							
	SARFAESI Act, 2002, are bein	g sold under the provisions of SARFAESI Act and Rules thereunder what is", and "Whatever there is" basis with all known and							
	unknown liabilities on 12/06/	2024							
		isus has taken physical possession of the below described secured							
	assets being immovable prope Rules thereunder.	rties on 29/10/2023 under the provisions of the SARFAESI Act and							
L ľ		ETAILS OF AUCTION ARE AS FOLLOWS:							
	Name of the Borrower(s),	a) Sarva Mangal Marketing (Borrower)							
	Co-Borrower(s) and Guarantor(s):	b) Mr. Ramesh Bhagwandas Khandelwal (Co-borrower)							
	Guarantor(s):	c) Mr. Mahesh Gajanand Khandelwal (Co-borrower) d) Mrs. Ashadevi Rameshkumar Khandelwal (Co-borrower &							
i L		Mortgagor)							
	Outstanding Dues for	Rs. 17,72,411.14/- (Rupees Seventeen Lakhs Seventy Two							
	which the secured assets are being sold:	Thousand Four Hundred Eleven And Paise Fourteen Only) as on 15/07/2021 as per notice under section 13(2) of SARFAESI Act.							
	are being bold.	(Rs. 28,93,000 (Rs. Twenty Eight Lakhs Ninety Three Thousand							
		Only) as on 01/02/2024 plus interest at the contractual rate and costs, charges and expenses thereon w.e.f. 02/02/2024 till the date							
		of payment and realization.)							
	Details of Secured Asset	Mortgaged by:- Mrs. Ashadevi Rameshkumar Khandelwal.							
	being Immovable Property which is being sold	All the piece and parcel of immovable property bearing Flat No. 2- G, 2nd floor, admeasuring 740 sq.ft. i.e. 68.75 sq. mtrs. along with							
	which is being bold	undivided share in land of "Saraswati Apartment", of Laxmi Flats							
		Co. Op. Society Ltd., situated at Old City Survey Nondh No 669,							
		New No, 668/A-2, Of Ward No. 1 of Monje Nanpura, City of Surat 395001 Near Jal Darshan Apartment, Navdi Owaro, Bahumali							
		Bhawan, Navdi, Nanpur, Surat 395001. Boundaries are as fol-							
		lows: Towards East: Open Space Towards South: Open Space							
۱ŀ	CERSAI ID:	Towards West: Passage Towards North: Lift. Security Id: 40027096804							
	CLINDRID.	Asset Id: 200027044890							
	Reserve Price below which	Rs. 14,48,000/-							
	the Secured Asset will not be sold (in Rs.):	(Rupees Fourteen Lakhs Forty-Eight Thousand Only)							
	Earnest Money Deposit	Rs. 1,44,800/-							
	(EMD):	(Rupees One Lakh Forty-Four Thousand Eight Hundred Only)							
	Claims, if any, which have	Not Known							
	been put forward against the property and any other								
	dues known to Secured								
	creditor and value								
	Inspection of Properties: Contact Person and Phone	01/06/2024 between 01:00 p.m. to 03:00 p.m. Mr Nilesh More – 9004722468							
	No:	Mr. Rohan Kadam- 9167981607							
	Last date for submission	11/06/2024 till 4:00 pm							
	of Bid: Time and Venue of Bid	E-Auction/Bidding through website (https://sarfaesi.auction-							
	Opening:	tiger.net) on 12/06/2024 from 11.00 a.m. to 01.00 p.m.							
ΙĒ	This publication is also a fiftee	n (15) days' notice to the aforementioned Borrowers / Co-Borrowers							
	under Rules 8 and 9 of the Se	curity Interest (Enforcement) Rules, 2002.							
11	rul use detailed terms and co	nditions of the sale, please refer to Secured Creditor's website i.e.							

er.net before submitting any bid. AUTHORISED OFFICER AUTHORISED OFFICER Pegasus Assets Reconstruction Private Limited (Trustee of Pegasus Group Thirty Nine Trust 2) ace: Surat ite: 25.05.2024

# AHMEDABAD | SATURDAY, 25 MAY 2024 Business Standard

DEBTS RECOVERY TRIBUNAL- I BAR ing Society, Nr. Kochrab indue to Banks & Fi See Rule 8(1) POSSESSION NOTICE (For immovable property) comprising Districts of Ahmedabad, Gandhinagar, Mehsana, Patan Sabari ogar), Banaskamha (Palanpur) of Gujarat State w.e.1. ts. June. 2007 ee Section 25 to 29 of the Recovery of Debts and Bankruptoy Act. 1993 read with Rule 2 of Second Schedule of the Income Tax Act-1961) ACPC-South under the Securitization and Reconstruction of Financial Assets an forcement of Security Interest (Aq.) 2002 and in service of powers confere-on me under section 13 (12) read with Rule 3 of the Security Interes forcement) Rules 2002, Issued a Demand Notice dated 04.03.2024 caling on the borrower Vilay Prajapati to repay the amount mentioned in the notic ing Rs 17.33.2171 (Rulpues seventeen labk eighty three thousand air dired seventy one only) as on 03.03.2024 under Home Loan accour 795645969, 397207160 further interest at the contractual relared and induce preses, costs, charges etc. thereon within 60 days from the date of receipt of the dnotoe. r.u. no. 195/2014 BANK OF BARODA, BAPUNAGAR BR. AHMEDABAD V/S. O.A. No. 111/2012 Certificate Holde M/S. SAI CREATION & ONE ORS. Certificate Debto Demand Notice CD No.1 M/s. Sai Creation on me under Section 13(4) of the said [Act] read with Rule 8 of the sand rues on me 18th day of May of the year 2024. The borrower, logal heirs (known - unknown), legal representatives (known unknown), guarantor and the public in general is heredry cautioned not to deal with the property and any dealings with the puperty will be subject to the charge of State Bank of India-RACPC-South for an amount of Rs 17.33,571/Rupese seventeer lake leight tyme to housand six hundred seventy one only as on 133.3322 under Home Loan account 39769545966, 3970072160 with further interest am b) (Decreament) is due againt you: ou are hereby called upon to deposit the above below sum within 15 days of the colorid the motics, failing which the recovery shall be made as per rules. additions to the sum aforesaid you will be liable to pay: 1) such interest 5 colors is payable interns of Recovery Conflicate. A lice to the sum aforesaid you will be liable to pay: 1) all costs, charges and expenses incurred in respect of the service of thin tonice and the process that may be taken for recovering the amount of the service. Safd Siven under my hand and the seal of the Tribunal, this 18th day of April, 2024. (Love Ku Recovery Offi DRT-I, Ahmed Home Loan account 39769545986, 39790721160 with further interest an tal expenses, costs, charges etc. thereon. rrower's attention is invited to provision of Sub-Section (8) of Section 13 of th respect of time available, to redeem the secured assets. Seal Next Date: 01.07.2024



Jaseeb. Interest England The Immovable property Mortgaged by the Borrower terredEquitable Mortgaged Property "Realestinal THE No.A.701,7" Floor, Block-A-Worksheldcorows and the source of the State State State State Worksheldcorows and the Scheme Known as "Ganeta Heights" Constructed Land bearing final plot no.217 of T2-Scheme No.30 In less of Ganeta Heights and bearing final plot no.217 of T2-Scheme No.30 In less of Ganeta Heights absd-1(Jaslal).

Authorised Officer (Sh.Amit Bargotra)



Directibali Balabhal Lathiya (Co-Borrower), Mrs. Sobhaben Directibali Balabhal (Co-Borrower), Mrs. Sobhaben Directibal Balabhal Cathya (Co-Borrower), Mrs. Sobhaben Directibal Balabhal Cathya (Co-Borrower), Mrs. or Shi floor of Balading Mentessiming Dubly up are 72:200 8(b) fals 16 7.15(a). Mrs. or Shi floor of Balading (FSDIB/NC)" and the whole complex is situated on the non-agricultural land bearing 164:00 Sqmrs von 4652 palaee. Bolck nor 753 palaee in 24mos 2000 46:200 Sqmrs von 4672 palaee. Bolck nor 753 palaee in 24mos 2000 47:20 46:700 Millione Biotechica Cathya Ca

# **Coromandel Engineering Company Limited**

CIN No: L7490TN1947PLC000343 SCON FUTURA' No.10/2, Old No. 56L, Venkatana ral@cec.coromandel-group.com Website: www.com

# EXTRACT OF THE AUDITED FINANCIAL STATEMENTS FOR THE QUARTER AND YEAR ENDED 31<sup>51</sup> MARCH 2024

				Rs. In lakhs	(except EPS)
PARTICULARS	Quarter ended 31-03-2024	Quarter ended 31-12-2023	Quarter ended 31-03-2023	Year ended 31-03-2024	Year ended 31-03-2023
Total Income from Operations	2405.78	2,158.88	2609.37	9,663.81	12,651.10
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/ or extraordinary items)	(21.58)	(73.68)	(211.86)	(383.07)	(583.83)
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or extraordinary items )	(21.58)	(73.68)	(13.37)	(361.86)	(385.34)
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or extraordinary items)	(16.17)	(106.74)	(47.64)	(439.71)	(450.86)
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	-	-	(1.08)	-	(1.08)
Paid-up Equity Share capital (Face Value of Rs.10 per share)	3,323.36	3,323.36	3,323.36	3,323.36	3,323.36
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year.				(5,371.79)	(4,919.85
Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) -					
Basic: (Rs.)	(0.05)	(0.32)	(0.14)	(1.32)	(1.36)
Diluted : (Rs.)	(0.05)	(0.32)	(0.14)	(1.32)	(1.36)
1. The above results were reviewed by Audit Committee and approve	t by the Board of Dire	ctors at their respec	tive meetings held o	on 24 <sup>®</sup> May 2024 .	
<ol> <li>The above is an extract of detailed format of Audited Financial resu- 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Reg exchange (www.bseindia.com) and Company's website (https://w</li> </ol>	ulations, 2015. The	full format of the Fin gg.com/)	ancial Results are a		ite of the stock

alal Sarabhai Enterprises Lin Kartikeya V. Sarabhai Chairman

Place: Chennai Date : 24<sup>th</sup> May 2024

Sd/ Sabaretnam Singaran Managing Director DIN: 00042329

# SATURDAY • 25-5-2024 03

### JAI HIND - AHMEDABAD

# સોનાના ઉંચા ભાવ: જુના ગોલ્ડની અદલાબદ રાખ્યું છે. અમે માગ નીચે કેરેટની સોનાની જવેલરી તરફ વળવાની અપેક્ષા રા

સંગઠિત સોનાના ઝવેરાતના છૂટક વિક્રેતાઓ ૨૦૨૪-૨૫માં વાર્ષિક ધોરણે ૧૭-૧૯ ટકાની આવક વૃધ્ધિની અપેક્ષા રાખે છે, જે દ્વારા સંચાલિત સોનાના ભાવમાં ઉછાળાને પગલે વેલ્યમાં ઉછાળો જોવાશે. જયારે વોલ્યમ સ્થિર રહેવાની

શકયતા છે. ચાલુ નાણાકોય વર્ષમાં સંગઠીત ગોલ્ડ જવેલર્સની આવકમાં ૧૭-૧૯ ટકાનો વધારો થવાની ધારણા છે, જયારે સોનાના વધતા ભાવને કારણે વોલ્યુમ ગ્રોથ અટકી જવાની શક્યતા છે, એમ ક્રિસિલ રેટિંગ્સે એક અહેવાલમાં જણાવ્યું હતું. અહેવાલમાં વધુમાં જણાવવામ

આવ્યું છે કે સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો અને નવા સ્ટોરના વધારાને કારણે ઉંચા ઈન્વેન્ટરી સ્તરને કારણે રિટેલરોની કાર્યકારી મૂડીની જરૂરિયાતો વધી શકે છે, જોકે, ક્રેડિટ પ્રોફાઈલ્સ સ્થિર રહેવી

ગુરા કળ,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયો હતો, એમ ક્રિસિલ રેટિંગ્સે જણાવ્યું હતું.

એપ્રિલ ૨૦૨૪માં સોનાના ભાવમાં આશરે રૂા.૭૬,૦૦૦ સુધીનો વધારો થયો હતો કારણ કે ભૌગોલિક રાજકીય અનિશ્વિતતાઓ વચ્ચે વિશ્વભરની વિવિધ કેન્દ્રીય બેંકો તેમજ અંતિમ ઉપભોકતાઓ દ્વારા જોવામાં આવતા સુરક્ષિત રોકાણ વિકલ્પોમાંના એક તરીકે સોનાએ તેની ચમક જાળવી રાખી હતી.

બ્રાંડિંગ અને માર્કેટીંગ ખર્ચમાં વધારો કરવા ઉપરાંત, રિટેલર્સ ખરીદદારોને વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરે તેવી શકયતા છે, તેમ છતાં તેઓ સોનાના ઉચા ભાવ વચ્ચે ગ્રાહકોને આકર્ષવા માટે પ્રોડકટ ડિઝાઈન અને ઓફરિંગને વધારવાનું ચાલુ

1 đ

એક્ટ્રેસ લેલા ખાનના હત્યારા પિતા પરવેઝને કોર્ટે આપી ફાંસીની સજા

મુંબઈ, તા.૨૪ એક્ટ્રેસ લૈલા ખાન મર્ડર કેસમાં કોર્ટનો ચુકાદો આવી ગયો છે. મુંબઈની સેશન કોર્ટે દોષિત છે. મુંબઇના સશન કાટ દાષતા પરવેઝ ટાકને ફાંસીની સજા સંભળાવી છે. અહીંધ્યાન આપવા જેવી બાબત એ છે કે, ૧૩ વર્ષ બાદ કોર્ટે આ કેસમાં સજાની જાહેરાત કરી છે. પરવેઝ ટાક મૃતક લૈલા ખાનનો સાવકો પિતા છે. ફેબ્રુઆરી ૨૦૧૧માં મહારાષ્ટ્રના ઈગતપુરીમાં એક ફાર્મ હાઉસ પર પરવેઝ ટાકે લૈલા ખાન અને તેના પરિવારના પાંચ અન્ય લોકોની નિર્મમ હત્યા કરી હતી અને લાશને જમીનની અંદર

હતી અને લાશને જમીનની અંદર દાંઢી દીધી હતી. લેલા ખાન મર્ડર કેસમાં ૯મેના રોજ સેશન કોર્ટે પરવેઝ ટાકને દોષિત કેરવ્યો હતો અને સજાની જાહેરાત પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. હકીઠનમાં જોઈએ તો, પ્રોયદ્રનિ દવદેન થયેલા વિભા બાદ પરવેઝ ટાકે પોતાની સાવકી ગાઇ સ્પ્લઝ ટાક માતા માસાવકા દીકરી લેલા ખાનની હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં કાતિલ પરવેઝે લેલાની માતા સહિત દ પરવઝ લલાના માતા સાહત દ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટના ફેબ્રુઆરી ૨૦૧૧ની છે.આ મામલામાં સૌથી પહેલા વર્ષ ૨૦૧૧માં મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં દ લોકોની મિસિંગ દઉપાદ ગાળે છ ફરિયાદ આવી હતી.

# વૈષ્ણોદેવી જતા શ્રદ્ધાળુઓની મિની બસને ટ્રકે મારી ટક્કર : ૭ના મોત

ડ્રેક મારા ૮ક્કર : હેળા માત અંબાલા તા. ૨૪ હરિયાણાના અંબાલામાં ગુરૂવારે મોડી રાત્રે એક ટૂક અને નિર્મા જા સ્વચ્ચે ટક્કર અને વિત્તી જા સ્વચ્ચે ટક્કર વાતે ક્રાર્ચિત સાર્જો એક જપરિવારના હતા. આ ઉપરાંત લગભગ ૨૫ લોકો થાયલ હોવાનું જાશાવવામાં આવી રહ્યું છે. તમને જાશાવી દઇએ કે આ રોડ અકસ્માતા દિલ્હી જમ્મૂ ગેશ્વનલ હોઈવ પર સ્વર્જોય છે.

કે આ રાડ અકસ્માત દિલ્હી જમ્મુ નેશનલ હાઇવે પર સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મિની બસમાં બેઠેલા લોકો વેષ્ણો દેવી દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. રસ્તામાં શ્રદ્ધાળુઓથી ભરેલી ભસ અને ટ્રક વચ્ચે ટક્કર થઇ હતી અને મિની બસનો કચ્ચરઘાણ વળી ગયો અને દુર પ્લ્ય દંગ્ ર પછે છાંતો અને મિની બસતો કચ્ચરપાક્ષ વળી ગયો હતો. બસમાં મુસાકરી કરનાર શિવાનીએ કહ્યું કં ડાઇવર દારૂગ પહેલાં (Teolf) તળારી ગયો. બસની એંદર 30 થી 3પ લોકો હતા અને વૈષ્ણો દેવી જઇ રહ્યા હતા. અમારી આંખ લાગી ગઈ હતી, ખબરન પડી કે અકસ્માત કેવી રીતે સર્જાયો. યૂપીના બાંદામાં એક બીપણ વેડ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. તો બીજી તરક અડો ડ. કહેવામાં આવી રહ્યું છે પૂરપાટ ઝડપે આવી રહેલા ટુકે આરોગ ટેલાર સારી હતી. વધી ઓટોમાં સવાર તમામ લોકોને ગ્લીર દીતે થાય છે. લોકોના મોત થયા છે.



આંકડામાં વૃધ્ધિ જોવા મળી છે. વોલ્યુમ જોતા ૨૦૨૪-૨૫માં સ્ટોર ઉમેરવાની ગતિ ૧૦-૧૨ ટકા સુધી મધ્યગ

દરમિયાન સ્થાનિક સોનાના બાવમાં ૧૫ ટકાનો ટ**ર્નઓવર વધરો પરંતુ 'વોલ્યુમ' સ્ચિર રહેશે** તૈરી જરો, બેઠે, સ્તાપિત ગેહડ જવેલરી દિટે વધારો થયો હતો અને માર્ચ ૨૦૨૪ના અંતે **ટર્નઓવર વધરો પરંતુ 'વોલ્યુમ' સ્ચિર રહેશે** તૈંક બંડોળની ઉપલબ્ધતામાં તાજેતરના વ

ગાહે અપલેલા શિટલામાં કોટ પ્રાફાળમાં માર્ગ્ય લેવા માર્ગ્ય લેવા રેટિંગ્સ ડાયરેકટટ હિમાંક શર્માએ જણાવ્યું હતું, નાણાકીય ૨૦૨૪માં દેવાનું ભારણ નિયંત્રણમાં રહેશે, નાણાકીય વર્ષ ૨૦૨૪માં સ્તરોથી માત્ર સહેજ મધ્યસ્થતા સાથે નેટ વર્થ અને વ્યાજ કવરેજ રેશિયોની કુલ બહારની જવાબદારીઓ અનુક્રમે

					No.	
ć	adani			ર્જી સોલુશન્સ લિમિટેડ	1	Total I
E	nergy Solutions	(અદાણી ટ્ર	ાન્સમિશન	ા લિમિટેડ તરીકે અગાઉ જાણીતા)	2	Net Pr
	૧૧મી બ	ાર્ષિક સાધારણ	સભાની	નોટિસ		(befor Extrac
અદ	ાણી એનર્જી સોલુશન્સ લિમિટેડ (ગ	અદાણી ટ્રાન્સમિશન	લિમિટેક ત	ટીકે અગાઉ જાણીતા ) ની ૧૧મી વાર્ષિક	3	Net Pr
સાદ	ારણ સભા (એજીએમ), કંપની ર	મદિનિયમ, ૨૦૧૩ ન	ની લાગુ જોગ	ાવાઈઓ અનુસાર તથા મિનિસ્ટ્રી ઓફ		Extrac
કાપ્	11૨૮ અફ્સના નવાનતમ પારપત્ર 1 એપ્રિલ, ૨૦૨૦, પરિપત્ર ન ૧૭	ન ૦૯/૨૦૨૩ તા. ૨ /૨૦૨૦ તા. ૧૩મી ૨	પમા સપ્ટમ્વ ક્ષેપ્રિલ, ૨૦૨	મર, ૨૦૨૩, પરિપત્ર નં. ૧૪/૨૦૨૦ તા. ૨૦ અંતર્ગત તથા સિક્યોરિટીઝ એન્ડ	4	Net Plafter t
એક	સ્સરોન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના	นโซนต . SEBI	HO/CFD	/CMD2/CIR/P/2021/11 dl. จนุมา		Extrac
no	થુઆરી , ૨૦૨૧ , પરિપત્ર નં. SEE	BI/HO/DDH/P/CIR	/2022/00	)63 તા. ૧૩મી મે, ૨૦૨૨, પરિપત્ર નં.	5	Total ( period
CE	BI/HO/CFD/P6D-2/P/CIR/203	23/001 પંચા જાન્થુ ની ઓક્ટોબર ૨૦૨	આરા, ૨૦૧	23 અને પરિપત્ર નં. SEBI/HO/CFD/ ર્ગત મંગળવાર ૨૫મી જૂન, ૨૦૨૪ ના	6	Equity Rs 10
SJU	r સવારે ૧૧.૩૦ કલાકે વિડિઓ	કોન્ફરન્સ (વીસી)	/ અન્થ ઓ	ડીઓ વિડિઓ માધ્યમ (ઓએવીએમ)	7	Reser
	ટા ચોબાશે , જેમાં એજીએમ નોટિસમ				8	Reval Earnir
qq:	માં અજીઅમના ઇલક્ટ્રાાનક નાર નીના વર્ષ ૨૦૨૩-૨૪ ના વાર્ષિક અ	ટસ ક જમા પદ્ધાત હેવાલ સાથે એજ સલ	તથા ઇ-વા મ્યો ને મોસ્લ	ટિંગના સૂચનો વર્ણવવામાં આવશે તે વવામાં આવશે , જેઓને ઇમેઇલ કંપની /	1	10 Ea Quart
	નોના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે					Comp
	ક્ષભ્યોના ઇમેઇલ નોંધાયેલા નથી તે					a) B b) C
		ઇલેક્ટ્રોનિક મતદા	न भाटेनी	લોગ-ઈન વિગતો માટે નીચે દશવિલ	Not	_
सूच ओ)	ાનાઓનું પાલન કરવાનું રહેશે : જેઓના શેગ ઉપ્રેટ પ્રાધ્યપ્ર છે -	ດ້ວຍ) ນາດາດາ ເຮົາກັດ	ແລງ ກາເຊຍ	સપન્ટ પાસે નોંધણી કરાવી શકે છે.	1	The abo consolic
છા) બી				ડ ટ્રાન્સફર એજેન્ટ — લિંક ઈનટાઈમ	2	These 1 Standar
	ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ને પ	મોતાના ફોલિયો નંબ	ાર તથા રવ	ધિકૃત પાન સાથે અરજી કરી શકે છે.	3	The Boa
	આ અરજી લિંક ઈનટાઈમ ઇન્ટિંગ ગાળ	જેચા પ્રાઈવેટ લિમિટે	ડ, પાંચમો ગ	માળ, ૫૦૬-૫૦૮ અમરનાથ બીઝ્નેસ્સ	4 1	Previou
	સટર -૫, ( અખાસા-૫ ), ગાલ મોકલવાની રહેશે અથવા <u>ahr</u>	nedabad@linkinti	ime.co.in	ઝેલિસબ્રિજ , અમદાવાદ - ૩૮૦૦૦૬ ને ઉપર ઇમેઇલ પણ કરી શકે છે.	0	The Fin
95	લભ્યો ડિમેટમા શેર ધરાવે છે તેઓ	માત્ર ૧૧મી એજીએમ	नी नोटिस व	તથા વર્ષ ૨૦૨૩-૨૪ ના વાર્ષિક અહેવાલ	Date	e: May :
	ાવવાના હેતુસર, ઉપર વર્ણવેલ છમે				Plac	ce: Ahm
				એજીએમ માં ભાગ લેવા માટે ના સૂચનો , અથવા જેમનો ઇમેઇલ નોંધાચેલ નથી		
તેઅ	નો માટે પણ ) ૧૧મી એજીએમ ની નો	ટિસ વર્ણવવામાં આવ	ાશે.			
993	મી એજીએમની નોટિસ તથા	an 5053-52	ના વાર્ષિક	ન અહેવાલ કંપનીની વેબસાઈટ - મસાઈટ <u>www.bseindia.com</u> તથા	1.5	ิว
	/w.nseindia.com ชินุรชินตง			ઝરાઇટ <u>www.bseindia.com</u> તથા ઝદાશી એનર્જી સોલુશન્સ લિમિટેક વતી		u
-				મિશન લિમિટેડ તરીકે અગાઉ જાણીતા)		
	ગઃ અમદાવાદ		A	જલધિ શુક્લ		
	ીખઃ ૨૫મી મે, ૨૦૨૪			કંપની સેક્રેટરી	E)	TRA
	<b>સ્ટર્ડ ઓફિસઃ</b> "અદાણી કોર્પોરેટ હા ાદાવાદ - ૩૮૨૪૨૧, ગુજરાત, ભારત		શોદેવી સકલ	પાસે, એસ. જી. હાઈવે, ખોડિયાર,	F	
şìa	d.: ૯૧ ૭૯ ૨૫૫૫ ૭૫૫૫   ફેક્સ	d.: 69 96 2444 9			S	
d0	alısa: www.adanienergysolu	tions.com   सीआ	<b>ຢ</b> ູ່ໜ້ <b>ດ</b> : L40	300GJ2013PLC077803	Ň	
'n.	HDFC BANK	એચડીએક	പിറും	લિમિટેક ડિમાન્ડ	1	To
ē.		194.12012.000		ालानट <b>ः</b> नोटिस ००७. होन : ०४६-९४८०७६९६	11	10 (lr
					2	Ne
	સિક્યોરિટાઇપ્રેશન એન્ડ રીકન્સ્ટ્રક્ય (એક્ટ)ની કલમ ૧૩(૨) ૨	ત ઓફ ફાચનાન્સિયલ એસેટ્ મંતર્ગત સિક્યોરિટી ઈન્ટરેસ્ટ I	સ છોલ્ડ છોલ્ફોસ 'છોલ્કોસમેન્ટ) 3	મેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, લ્સ ૨૦૦૨ ના નિયમ 3 સાથે વાંચતાં		(b
	ર્બી નીચે સહી કરનાર એચડીએફસી બેન્ક લિમિટેક (બૂત	ારળમાં એચડીએફસી વિદ, જેનું ન	ામકાર એનસીએલ્સ	ી-મુંબઈ ના તારીખ ૧૭ માર્ચ, ૨૦૨૩ના આદેશ મુજબ મંજૂર થયેલ	3	Ne
મોક સિ	ક્વોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ અને સિક્વોરિટી ઈન	ટરેસ્ટ (એન્કોર્સમેન્ટ) ઉલ્સ ૨૦૦૨	ના નિયમ 3 સાથે વાંગ	શન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સપેન્ટ ઘતા કલમ૧ ૩ (૧ ૨) હેઠળ તેમને મળેલ સત્તા હેઠળ; અહીં નીચે દશવિલ	4	be
મોરોઅ <b>ન</b>	ર(સે)/લીગલ વારસદાર(સે) લીગલ પ્રતિનિષિ(ઓ) ને ઉપરો	ક્ત એક્ટ કલમ ૧૩(૨) હેઠળ ડિમાન	ડ નોટિસ પાઠવવામાં	આવેલ છે. જે અનુસાર જે તે ડિમાન્ડ નોટિસમાં નોટિસ મથ્યા તારીખથી દીગલ પ્રતિનિધિ(ઓ)ને છેલ્લામાં છેલ્લા જાણીતા સરનામાનાં સ્થળે આ	17	ta
FRSIG	પ્રોંટાડવાની કરજ પડેલ. આ નોટિસોની નકલ નીચે સહી કરનાર	પાસે ઉપલબ્ધ છે અને ઉપરોક્ત બોર	ાય વાલ્લકાર(લ) // અર(સ) લીગલ વાર	માનવ આવાગા વાલ્યમાં છે છે છે છે તો તેઓ નીચે સહી કરનાર પાસેથી સદાર(શે)/પ્રતિનિધિ(ઓ) જો ઈચ્છો તો તેઓ નીચે સહી કરનાર પાસેથી	5	To
82-154 (	ય ઓફિયા કાપકાજના દિનાયોએ કાપકાજના પ્રાપ્યન્ય પ્રથય દ ઉપરોક્ત ભાખતના અનુસંધાનમાં આ સાથે ફરી એકવાર બો	પપિયાન મેળની થકે છે. રોઅર(સં)/લીગલ વારસદાર(રો)	લીગલપ્રતિનિધિ(ગ	તો)ને નોટિસમાં આપવામાં આવે છે કે આ નોટિસ પ્રસિધ્ધ થયાના ૬૦		{C
દેવસમ રાવવા	ાં અહીં નીચે તેમના જે તે નામે દર્શાવેલ રકમ ડિમાન્ડ નોદિ ની રહેશે. જેમાં. વધારાનું વ્યાજ અને પ્રાસંગિક ખર્ચા, કોસ	દેસમાં દર્શાવ્યા મુજખની, નીચે કોલ ૮. ચાર્જિસ. એક્સ્પેન્સીસ. વગેરે બ	ક્ષ્મ (સી)માં દર્શાવે છી નીકળતી તારીખ	તો )ને નોટિસમાં આપવામાં આવે છે કે આ નોટિસ પ્રસિધ્ધ થયાના ૬૦ ધ તારીખથી ચુકવાય તે તારીખ સુધીની રકમ <b>એલક્રીએફસીમાં જમા</b> શ્રી સંપૂર્ણ ચુકવણી કરાય/જમા થાય ત્યાં સુધીના ગણતરીમાં લેવામાં		(a) Co
					6	Pa
યોતાની	મારાઅર(સ)/ કાવદસરના વારસદાર(રા)/ કાવદસરના: સલામતઅસ્કથામત/છોડાવીલે.	પ્રાતાનાથાં આ /નું બ્યાન દારવામાં ર	તાવ છ ક અક્ટના ક	લમના ૩ ની પેટા કલમ (૮)ની જોગવાઈઓ અનુસાર સમય રહેતાં		(F
અનુ.	બોરોઅર(સી)/ગેરન્ટર(સી) કાયદેસરના	કુલ બાકી	ડિમાન્ડ નોટિસ	સ્થાવર અસ્કયામત(તો)	7	Ot
÷	વારસદાર(રો) અને કાયદેસરના પ્રતિનિધિ(ઓ)નાં નામ	લેણી રકમ	તારીખ	સ્થાવર મિલકતોનું વર્ણન	8	Ba
(એ)	(M)	(સી)	(ઊ)	(6)	l°.	Ba
9	્રો. યોગેશ આર. પ્રજાપતિ (બોરોઅર)	31. 59,65,026/-,	(ગ)	્() યુનિટ - ૦૪ - ગ્રાઉન્ડ ફ્લોર, વેદાંત એઓન, પ્લોટ		(N
	શ્રીમતી રૂપલબેન ચોગેશકુમાર પ્રજાપતિ	31. 6, 80, 684/-,	5058	એફ. પી દ્વ/ (૧ + ૨), સ. નં. ૯७/પી, વેદાંત		otes
	(કો-બોરોઅર)	રૂા.૨૮,૩૧,૮૦૩/- અને રૂા.૧,૦૨,૮૨૩/-		એઓન, એસ.પી. રીંગ રોડ, કરાઇ ક્રોસ રોડ,	1.	Keyn
	a la hach he a new of a warmen for			tiples un und attent Steller america		
	મે. વાત્સલ્ય હોસ્પિટલ & સોનોગ્રાફી સેન્ટર (કો-બોરોગ્રાર)	અનુક્રમે ૩૦ એપ્રિલ,		પેટ્રોલ પંપ પાસે, નાના શિલોડા, અમદાવાદ- ૩૮૨૩૩૦.		
	મે. વાત્સલ્થ કોસ્પિટલ & સોનોગ્નાફી સેન્ટર (કો-બોરોઅર) ૧૬૪૧૬૫ - ૬૩૫૨૯૩૯૫૯, ૬૩૫૫૩૯૯૮૩,					
	(કો-બોરોઅર)	અનુક્રમે ૩૦ એપ્રિલ,	0 X Å		To	otal Ir

સનુ. નં	બોરોઅર(સ)/ગેરન્ટર(સે) કાયદેસરના વારસદાર(રી) અને કાયદેસરના પ્રતિનિધિ(ઓ)નાં નામ	કુલ બાકી લેણી રકમ	ડિમાન્ડ નોટિસ તારીખ	સ્થાવર અસ્ક્યામત(તો) સ્થાવર મિલકતોનું વર્ણન
(એ)	(A)	(સી)	(8)	(8)
٩	ડો. ચોગેશ આર. પ્રજાપતિ (ભોરોઅર) શીમતી રૂપલબેન થૉગેશકુમાર પ્રજાપતિ (લો-બોરોઅર) મે. વારલશ ફોસ્પિટલ & સોનોગ્નાફી સેન્ટર (લો-બોરોઅર) વદુજરદ્દય - દુઽપરસ્ટરલ્પર, દુડાપરસ્ટલ્ટ, દ્રપ્રસદ્દરહદ્દા અને દુસ્પરલ્ટ્ર બ્લ	રૂંા. દ્વ,૯દ્,૭૮૯/-, રૂા. ૧,૬૨,૭૧૫/-, રૂા. ૨૮,૩૧,૮૦૩/- અને રૂા. ૧,૦૨,૨૨૩/- અનુક્રમે ૩૦ એપ્રિલ, ૨૦૨૪ ના રોધ <sup>ક</sup>	૮ મે, ૨૦૨૪	ધુનિશ્ટ - અર - સાઉન્ડ ફ્લોર, વેદાંત એઓન, ખોટ એફ. પી દુવ/ (૧ + ૨), સ. ન. હણ/પી, વેદાંત સંસ્ટોન, સેસ્સ. શી. સેંગ સેક, ક્લાય કોસ રોક, પેટ્રોલ પંપ પાસે, નાના વિલોડા, અમદાવાદ- ૩૮૨૩૩૦.
ŝ	શ્રી દિલીપ રેલ્લુમલ ચેલ્લાની (બોરોઅર) ૧૫૩૩૨૫ - ૬૩૩૮૧૦૪૫૧, ૬૩૪૨૯૫૦૪૬ અને ૬૫૮૦૪૦૩૧૬	રૂા.૨७,૩७,૬૧૨/-, રૂા.૧,૧૧,७૧૪/- અને રૂા.૮૦,૮૯૯/- અનુક્રમે ૩૦ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ <sup>4</sup>	૧૪ મે, ૨૦૨૪	૧૩૦, પહેલો માળ, સુયેલ બિઝનેસ પાર્ક -ા∨, પ્લોટ એફ. પી ૬૨, સ. નં ૧७૨ + ૧७૩/પી, ટી. પી. ૧૬, અરવિંદ મિલ પાસે, નરોડા સેડ, નરોડા, અમદાવાદ - ૩૮૨૩૩૦.
ષ્ટ્રે ઘગુ પડ અં મેચક્ત( તેગવાઈ તારીખ	ા તમામ નિયમો તેઠળ કામકાજ કરવામાં આવશે. જો બોરોઅર (સં <b>સક્રીએફસી</b> ની. લેખિત પૂર્વ સંમતિ વગર ઉપરોક્ત બોરોઅર(	ો <b>એચડીએફસી</b> દારા ઉપરોક્ત )/લીગલ વાસરદાર (રો)/લીગલ 'સ)/લીગલ વારસદાર (રો)/ લીગ	સેક્યોર્ડ અસ્કયામત( પ્રતિનિધિ(ઓ) ના ખ ગલ પ્રતિનિધિ(ઓ)-	તો)/સ્થાયી મિલકત (તો) સામે ઉપરોક્ત કાયદાની કલમ ૧૩(૧૪) અને

••••••=••	_				
<b>લાખ્યદલી વધરો</b> તેનાની જ્વેલરી તફ વળવાની અપેક્ષા રાખીએ ાટે ગોલ્ડ એકસચેન્જ પ્રોગ્રામનું પ્રમોશન આગળ જ્યાદિત્ય ગાવરે જણાવ્યું હતું પરિણામે મોટા	આથી પ્લેજ્ડ છે ના પાસર્થ	(ઝેન્કોર્સમેન્ટ) અ જાહેર જનતાને સામાન્ય રી / ચાર્જ હેઠળ /મોર્ગેજ કરેલી આદ્યારે" બેંકના બાકી લેણ	વેસી ભાર, પાંસ્ટ સ્વપ્યુપ, અમદાવાન- ડેટ૦૦૦ 6-પીચ, Phone no. 079-2211425, 2214 Mobile No. 9978445541, www.bankofbar જીટ્રરાબા અને દુ: ગામને અપ્રેસ્ટ અને અને સ્વ સ્વ ૨૦૦૨ના અલ ક(ર) આને અલ ડ(ક) સાથે વંચા તે અને સ્વાહાર્તા(ઓ) અને ગેસ્ટરર(રો)ને ખાસ કડીને ની છે, જેનું ઉક્કે આંક બરોતાના અધિક્રત આપ્રિસ્ટાર)નેરે માટે છે ડરાજાથી વધ્યા કરવાને નર્સ્ટ્રી કલમાં આવે છે.	ર, ૧૪૨૧, 5710, oda.com appendix and appendix (see provise a) તેનાં સાલ્ય ગિલકાનો ત્રી છે અનેર અગ્લ a) તેનાં સાલ્ય ગિલકાનો ત્રી સાલ્ય ગે તેનું ની પે જ્યાવે તે બિલકાનો જે બે સ કબણે સેળવી વીધેલ છે તેનું ની પે જ્યાવે તે બિલકાનો જે બે જાયવેલ બાતાનો પે કપી, પી ડે, વ્યાકેટરો, ભગીવાટ 3, ત્રષ્ઠા કની જ્યાવે વાર્ષ કપી, પી ડે, વ્યાકેટરો, ભગીવાટ	to Rule 6 (2) & 8 (6)) ઝાને સિક્સોરિટી ઇન્ટરેસ્ટટ વેચાણ નોટિસ. ઓફ બરોડાને હાઈપોપિકેટેડ/ જ્યાં છે જેમ છે, જે કંઇ છે તે , ઝળક્રતાઓ અને જામીનદારો
એકસચેન્જ સ્કીમનો હિસ્સો અકંદર વોલ્યુમના ∎ લગભગ ત્રીજા ભાગથી વધવાની ધારણા છે.	ક્રમ. લોટ નં.	આગરુતાં/ઓ/ જામીલદાર/રો ના નામ અને સરનામા	જાણીતા લોજા સાથેતું સ્વાવર મિલકતનું વિગતવાર વર્ણત, જો કંઇ હોય તો	ડીમાન્ડ લોટિસ મુજબ બાકી લેણાં (ડીમાન્ડ નોટિસ જારી કર્યા બાદ આવેલ રિકવરી બાદ કરીને) વત્તા તેની પર વ્યાજ	રીઝર્વ પ્રાઇઝ, અનેંસ્ટ મનિ ડીપોઝીટ ઇએમડી અને બ્રીડ વધારાની રક્તમ
વધુમાં સંગઠિત છુટક વિક્રેનાઓ અસંગઠિત લોકોના ભોગે બજાર હિસ્સો મેળવવાનું ચાલુ રાખશે. ગ્રાહકોની પસંદગીઓ અને સ્ટોરના વિસ્તરણને ટાવર ૧ અને ૨ શહેરોમાં અને	9	ઉત્ત વાલાય ગ્રોતંક્રભાઇ અંબાલાલ ગ્રોતંકી (ૠશકતી) એકતાબેન ગ્રુતેન્દ્રભાઇ શોતંકી (સદ- ૠશકતી)	જીતેન્દ્રભાષ અંદબાલાલ જોલંકી ની માલિકીની સ્પાવર મિલકાનનો નમામ ભાગ અને હિસ્સો-રહેણાં કે બોટ ઈ- ૧૧ એવીયા આશરે ૯૩ ચો.મી., આરએસ નં. ૨૯૭૧/ ૨, ૨૯૭૧/૨ ચી.૧. ૨૯૭૧/૨૨ મોજે માલાસા, નાલુકો માલામા, ૨૭. જિલ્લો ગાંધીનગર ખાતે આવેલ છે. વતુ:સીમા: પૂર્વે માર્જન પહેલ, પશ્ચિમે પલ્લિક વે, ઉત્તરે પ્લોટ નં. ૨. ૬ દિશિલે માર્જન પહેલ	રૂા. ૭,૪૯,૨૦૦૯/ (રૂા. સાત લાખઓગલાપચાસ હજાર અસાં છ પુરા) તા ૨૦-૦૨-૨૦૨૩ ગા રોજ + કોન્ટ્રેક્ચ્યુઅલ ટેટ યુજબ વ્યાજ અને અન્ય અચીઓ ત્યારબાદ આવેલી રીકેલરી બાદ કરીને જો કંઇ હો વતી કલપ ૧૩(૨) તા. ૨૦-૦૨-૨૦૨૩ યુજબ શ્રીમાન્ડ નોટિસ	રીઝર્વ પ્રાશઝ- રૂા. ૧૦,૦૦,૮૦૦/- ઘએમડી રૂા.૧,૦૦,૦૮૦/- બીડ વધારાની સ્કમ રૂા.૧૦,૦૦૦/-
ગ્રામ્ય વિસ્તારો ઢારા સમર્થન આપવામાં આવશે. ક્રિસિલ દેટીંગ્સે વધુમાં જણાવ્યું હતું કે, તંદુરસ્ત બેલેન્સ શીટ ઢારા માગના ટેકાએ, સ્ટોર વિસ્તરણ (મુખ્યત્વે મોટા જવેલરી	ş	ગુતેન્દ્રભાઇ અંબાવાલ શોલંકી (ગ્રાશકતી) એક્તાબેન ગ્રાતેન્દ્રભાઇ શોલંકી (સદ- ગ્રાશકતી)	છુતેન્દ્રભાઇ અંબાવાલ સોલંકી ની માહિકીની સ્થાવર થિલકનનો તમામ ભાગ અને હિસ્સો રહેલાંક બ્લોટ એક ૧૦ એરિયા આશરે ૯૦૦ થો.મી., આરએસ ને ૨૯૦૧/૨, ૨૯૦૧/૨ ધેઠી ૧, ૨૦૦૧/૨/૨ મોઝે માણસા, લાણુકી માજસા ૨૦૦ હિલ્લો ગોધીનગર ખાતે આવેલ છે. જાત:સીમા : પૂર્વે માર્જીન પહેસ, પશ્ચિમે પબિલક હે, ઉત્તરે માર્જન પહેસ.	રા. ૮.૨૨,૦૦૧)- (રા. આઠ લાખ ભાવીસ હજાર એકસક 141) તા ૨૦૦૨-૨૦૨૩ ના ૨ોજ + કોન્ટ્રેક્ચ્યુઅલ ટેટ મુજબ વ્યાજ અને અન્ય ખવાંઆ ત્યારબાદ આવેલી રીકવરી બાદ કરીને, જે કંઇ હોય તો. કલ્લા ૧૩(ર) તારીખ ૨૦૦૨ - ૨૦૨૩ મુજબ ડીમાન્ન નોટિસ	રીઝર્વ પ્રાઇઝ- રા. ૬,૮૮,૨૦૦/- ઇઝેમડી રૂા.૯૮,૮૨૦/- બીડ વધારાશી ૨૭મ રૂા.૧૦,૦૦૦/-
રિટેલર્સ દ્વારા)ને કારણે રોગચાળા પછી મજબૂત બે આંકડામાં વૃધ્ધિ જોવા મળી છે. સપાટ ઉમેરવાની ગતિ ૧૦-૧ર ટકા સુધી મધ્યમ રહી થવાના પરિણામે આ નાણાકીય વર્ષમાં સોનાની	3	મે. વાસ્તુ એક્વેરિયમ (પ્રોપ.જીતેન્દ્રભાઇ અંભાલાલ સોલંકી)	ઉપરોક્ત બન્ને મિલકતો મે. વાસ્તુ એક્વેરિયમ (પ્રોય. જીતેન્દ્રભાઇ અંબાલાલ સોલંકી) ને અપાયેલી સુરક્ષિત સુવિધા માટે પલ મોર્ગેજ કરવામાં આવી છે.	રૂા. ૧૭, ૨૯, ૩૯૪/- (રૂા. સત્તર લાખ ઓગણત્રીસ હજાર વર્લ્સો ચોરાલું પૂરા) તા ૨૦-૦૨-૨૦૨૩ ના રોજ + કોન્ટુક્ચ્યુઅલ ૨૨ મુજબ બાજ અને અન્ય ખ્યાંઓ ત્યારખાઈ ગાયેલી રોઠયરી બાદ કરીને, જો કંઈ હોય તો. કલમ 1૩(૨) તારીખ ૨૦-૦૨-૨૦૨૩ મુજબ ડીમાન્ડ નોટિસ	
			ની તારીખ ૧૨-૦૬-૨૦૨૪ -સમચ બપોરે ૦૨ :ન		
ન્ટરી વધુ કિંમતે ઉંચી રહેશે. આ, નવા સ્ટોર્સ પર			નિરીક્ષણની તારીખ અને સમય : ૦૯/૦૬/૨૪		
ો ઈન્વેન્ટરી સાથે, ઉચ્ચ કાર્યકારી મૂડીનું દેવું તરફ જશે, જોકે, સ્તાપિત ગોલ્ડ જવેલરી રિટેલર્સને			નેયમો માટે https://www.bankofbaroda.in/e ર જણાવેલ ટેલિફોન નંબર પર સંપર્ક કરી શકે છે.	auction.htm and https://ibapi.in પર આપે	
ભંડોળની ઉપલબ્ધતામાં તાજેતરના વર્ષોમાં			પ્રમાણે ગ્રાણકર્તા/જામીનદાર/મોર્ગેજરને યેદ્યાનિક -૧૫- દિ		Ficted and
માં ચાલુ રહેવાની ધારણા છે, એમ ઉમેર્યું હતું. પર્યાપ્ર નકાકારકતાને કારણે પ્રજબત રોકડ	alle	स भूपप) (मरी हेवी सने ।	ने आधी नोटिस आपपामां आपे छे डे तेओसे ढ़राछुर्न घो तेम डरवामां डसुर थगे तो सिड्योर्ड पिलडतोनी ढर  / मोर्जेफर पासेथी पए। वसूल डरवामां आवशे		SHELL HIS SHELL

METROGLOBAL LIMITED

તારીખ : ૨૪-૦૫-૨૦૨૪, સ્થળ : અમદાવા

24, 2024 nedahad

75 Regd. Office: 506-509, Shilp, Opp. Girish Cold Drinks, C.G. Road, Navrangpura, Ahmedabad - 380009, Gujarat Email : <u>cs@metroglobal.in</u>, Website : <u>www.metrogloballimited.com</u>, CIN: L21010GJ1992PLC143784 METROGLOBAL STATEMENT OF FINANCIAL RESULTS FOR THE QUARTER AND FINANCIAL YEAR ENDED MARCH 31, 2024

		STANDALONE						C	ONSOLIDATI	ED	
r.	Particulars		Quarter End	ed	Year	Ended		Quarter End	ed	Year	Ended
0.	Particulars	31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2023	31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2023
		Audited	Unaudited	Audited	Audited	Audited	Audited	Unaudited	Audited	Audited	Audited
1	Total Income Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or	6,583.90	7,118.51	8,023.67	24,592.43	24,772.26	6,593.36	7,120.50	8,023.78	24,604.51	24,772.97
3	Extraordinary items) Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or	1,036.94	521.97	911.93	2,090.04	2,428.10	1,059.68	519.74	911.29	2,130.09	2,433.81
4	Extraordinary items) Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or	1,036.94	521.97	911.93	2,090.04	2,428.10	1,059.68	519.74	911.29	2,130.09	2,433.81
5	Extraordinary items) Total Comprehensive income for the	792.86	403.38	719.49	1,588.64	1,907.49	815.38	401.04	718.80	1,628.49	1,913.14
6	period Equity share capital (Face Value of	727.71	1,248.73	(931.09)	3,650.98	476.02	761.73	1,253.74	(852.77)	3,730.48	560.68
7	Rs 10/- each ) Reserve and Surplus (excluding Revaluation Reserve)	1,233.44	1,233.44	1,233.44	1,233.44 35,726.55	1,233.44 32,383.93	1,233.44	1,233.44	1,233.44	1,233.44 35,801.37	1,233.44 32,387.65
8	Earnings Per Share (EPS) (of Rs. 10 Each) (Not annualized for Quarters) (Including Other Comprehensive Income)										
	a) Basic b) Diluted	5.90 5.90	10.12 10.12	(7.55) (7.55)	29.60 29.60	3.86 3.86	6.18 6.18	10.16 10.16	(6.91) (6.91)	30.24 30.24	4.55 4.55

held on May 24, 2024. The ("Ind As") notified under the Co face value of Rs.

# <sup>®</sup> Ambalal Sarabhai Enterprises Limited<sup>®</sup> CIN: L52100GJ1978PLC003159

Regd. Office: Shanti Sadan, Mirzapur Road, Ahmedabad - 380001

Phone : 079-25507671, 25507073 | Website: www.ase.life | E-mail: ase@sarabhai.co.in ACT OF AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2024

			Quarter ended	1	Year	ended
Sr. No.	Particulars	31.03.2024		31.03.2023		1
NU.		Audited	Unaudited	Audited	Audited	Audite
1	Total Income from Operations (Including Other Income)	5913.49	4447.35	4880.01	18394.52	18277
2	Net Profit / (Loss) for the period (before tax and exceptional items)	829.10	203.44	715.08	665.10	1517
3	Net Profit / (Loss) for the period before tax and after exceptional items	829.10	203.44	715.08	665.10	1517
4	Net Profit / (Loss) for the period after tax and exceptional items	901.83	133.28	571.16	568.07	1144
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)}	922.12	108.81	538.94	632.65	1071
6	Paid-up Equity Share Capital (Face Value ₹ 10/- Per Share)	7663.33	7663.33	7663.33	7663.33	7663
7	Other Equity as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	6049.95	5428
8	Earnings Per Share (of ₹10/- each) Basic and Diluted Earning Per Share (Not Annualized) (in ₹)	1.18	0.18	0.76	0.74	1
Not 1. Ki	es : ay numbers of Standalone Results are as under:					(₹ in Lal
			Quarter ended	1	Year	ended
	Particulars		31.12.2023			
-		Audited	Unaudited	Audited	Audited	Audit
	al Income from Operations (including Other Income)		165.24			
	Profit / (Loss) before tax	266.18	(38.46)		81.45	433
	Profit / (Loss) after tax	469.72	(65.09)	111.65	258.32	411
3. T 4. T	The above is an extract of the detailed format of the Financial E, shock Exchange under Reputition 30 of the SEB1 (Listing Obligat of the Standulone and Consolidated Financial Results are availab company's Website (www.sasilfe). The above financial results have been reviewed by the Audit Con soard of Directors at their meeting held on 24th May, 2024. Here results have been prepared in accordance with the Companies Ard 2010 133 of the Companies Ard 2013 and other recognition Inder Section 133 of the Companies Ard 2013 and other recognition (1990) 1990 1990 1990 1990 1990 1990 1990	tions & Disclo le on the webs nmittee at thei nies ( Indian A zed accounting	sure Requirem ite of the Stock r meeting held ccounting Star g practices and	nents) Regulat k Exchange (w on 24th May, ndards ) Rules policies to the	ions, 2015. Th ww.bseindia. 2024 and app 2015 ( Ind AS a extent applic	he full for com) and proved by 5 ) prescri able.
5 1						

તંદુરસ્ત બેલેન્સ શીટ દ્વારા માગના ટે . ટોરૅવિસ્તરણ (મુખ્યત્વે મોટા જવે ટેલર્સદ્વારા)ને કારણે રોગચાળા પછી મહ 

છીએ અને વોલ્યુમને ટેકો આપવા માટે ગોલ્ડ એકસચેન્જ પ્રોગ્રામનું પ્રમોશન અ વધશે, એમ ક્રિસિલ રેટિંગ્સ ડિરેકટર આદિત્ય ઝાવરે જણાવ્યું હતું. પરિણામે

આ છું આ આ પ્લેમ ગાળામાં ચાલુ રહેવાની ધરલબ્ધતામાં તાજેતરના વર્ષોમાં સુધારો થયો છે. આ મધ્યમ ગાળામાં ચાલુ રહેવાની ધરણા છે, એમ ઉમેર્યું હતું સ્વસ્થ આવશુ વિદ્ય અને પર્યાપ્ત નકારાકરાનો કારણે મજબૂત રોકડ જનરેશન, કાર્યકારી મૂડી ઉધારવામાં અપેક્ષિત વધારો હોવા છતા, સંગઠીત ગોડડ જવેલરી સ્ટેલસંની ક્રેડિટ પ્રોફાઈલને સ્ટિંગ રાખશે. ક્રિસિલ

૧.૦-૧.૧ ગણા અને ૮.૦-૮.૨ ગણા અપેક્ષિત છે